

સિટી આજે બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડનું અનાવરણ કરશે



બ્રમ્પટન, ઓન્ટારિયો (24 મે 2022) – આજે સિટી ઓફ બ્રમ્પટને બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડનું અનાવરણ કર્યું હતું, જે એક પહેલવહેલી વખત ઊભી કરેલ સ્વયં-ટકાઉ રહેતી, શુદ્ધિકૃત ખોરાક પ્રથા છે જે બ્રમ્પટનના અનેક પરિવારો માટે ખોરાક ઉત્પન્ન કરશે.

બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડ આ ઉનાળાથી બ્રમ્પટન પાર્ક્સ અને બ્રમ્પટન ફાયર સ્ટેશન 212 માં સ્થિત છે અને તેમના દ્વારા જ ચલાવાશે. શેડ નેચર હાર્મની (Nature Harmony) દ્વારા પૂરું પાડવામાં આવશે અને તે એક શૂન્ય ઊર્જા ગ્રીનહાઉસ માળખું છે. ફૂડ શેડમાંથી જે પાક પેદા કરશે અને તે રિજનરેશન આઉટરિચ કમ્યુનિટીને દાન કરાશે જેથી બ્રમ્પટનના પરિવારોને પોષી શકાય, જે બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામનો ભાગ છે.

આ નવીન તકનીકમાં પોતાની ઈકોસિસ્ટમ છે જેમાં સંયુક્ત રીતે માટી આધારિત વિકાસ, હાયડ્રોપોનિક્સ, અને એકવાપોનિક્સ સિસ્ટમો વપરાશે જેથી ખાવાલાયક ઓર્ગેનિક ફળ અને શાકભાજી અને ખાવાલાયક માછલી પણ પેદા થઈ શકશે. આ શેડ શૂન્ય-બગાડ અને કાર્બન નેગેટિવ હશે.

જેને સૌર પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચલાવાશે જેનું બાંધકામ કઠોર શિયાળાને ખમી શકશે. ટકાઉ ઈન્ડોર ફાર્મ દરેક ઉંમરના હાજર રહેતા લોકોને એક ઈન્ટરએક્ટિવ શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે છે જેથી તેઓ આ શેડ આપી શકે એવા વિવિધ લાભનું અવલોકન કરી શકે.

બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડ [બ્રમ્પટન ગ્રો ગ્રીન પર્યાવરણીય માસ્ટર પ્લાન](#) ના લક્ષ્યોને આગળ ધપાવે છે, જેના દ્વારા શહેરી કૃષિને શહેર માટેના એક અવસર તરીકે ટાંકવામાં આવ્યો છે.

સુવાક્યો

"બ્રમ્પટન સીટી કાઉન્સિલે મે 2021માં ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડને મંજૂરી આપી હતી. એક હરિયાળા શહેર તરીકે અમને બ્રમ્પટનમાં ટકાઉપણના મોડેલો સ્થાપવાનો ગર્વ છે અને આ ઓર્ગેનિક શેડને સહાયરૂપ થવા ઉત્સુક છીએ. નેચર હાર્મનીના સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડ શહેરી કૃષિનો મીલનો પત્થર છે જે પોતાની ઊર્જા ઉત્પન્ન કરે છે અને શૂન્ય-બગાડ પ્રથા જાળવે છે, વરસાદના પાણી લણે છે તેમજ કાર્બનને કેદ કરીને તાજું ઓક્સિજન મુક્ત પાણ કરે છે. આપણો સમાજ ટકાઉ ભવિષ્યનો હાથ પકડે છે તે વખતે અમે માર્ગ ચીંધતા અતિશય રોમાંચિત છીએ."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડ એક નવીન પહેલ છે જે બ્રમ્પટન ખાતેના જરૂરિયાતમંદોની સહાય કરશે. અમે ફૂડ શેડમાંથી થતી પેદાશોને બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામના ભાગરૂપે રિજનરેશન આઉટરિચ કમ્યુનિટીને દાન કરીશું જેથી બ્રમ્પટનના પરિવારોને પોષી શકાય."

- ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, પ્રમુખ, બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ, સિટી ઓફ બ્રમ્પટન

"સિટી બ્રમ્પટનમાં ખોરાકી સલામતી અને પર્યાવરણીય ટકાઉપણની તકો પ્રત્યે પ્રતિબદ્ધ છે. બંબાખાનાના (ફાયર સ્ટેશન) અમારા કર્મચારીઓને બ્રમ્પટન ગ્રોઝ ઓફ-ગ્રિડ શેડમાં સહાયરૂપ થવા માટે તાલીમ આપવામાં આવશે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca